

# બેક્સ્ટર ગ્લોબલ સ્કોલરશિપ પ્રોગ્રામ(Baxter Global Scholarship Program)

જે લોકો તેમના કોલેજ અથવા વોકેશનલ સ્કૂલ પ્રોગ્રામના શિક્ષણને યાલુ રાખવાની યોજના કરતા હોય તેવા યોગ્યતા ધરાવતા Baxterના કર્મચારીઓને સહાય કરવા માટે Baxter International Foundationને સ્પર્ધાત્મક, યોગ્યતા આધારિત શિષ્યવૃત્તિ પ્રોગ્રામ સ્થાપિત કર્યો છે.

**આ શિષ્યવૃત્તિ પુરસ્કારની રકમ \$3,000 USD છે.**

આ પ્રોગ્રામનું સંચાલન સ્કોલરશિપ અમેરિકા\* દ્વારા કરવામાં આવે છે, જે કોર્પોરેશન, ફાઉન્ડેશન, અસોશિયેશન અને લોકો માટે શિષ્યવૃત્તિઓ અને અન્ય શૈક્ષણિક સર્પોર્ટ પ્રોગ્રામોના દેશના સૌથી મોટા ડિઝાઇનર અને મેનેજર છે. વ્યક્તિગત પ્રોગ્રામો માટેની યોગ્યતા પ્રાયોજકની પોતાની વિવેકબુદ્ધિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને યોગ્યતા ધરાવતી અરજીઓની સ્કોલરશિપ અમેરિકાની મૂલ્યાંકનકર્તા ટીમ દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. પુરસ્કારો વંશ, રંગ, સંપ્રદાય, ધર્મ, જાતીય અભિગમ, લિંગ, વિકલાંગતા, નાણાકીય જરૂરીયાત અથવા રાષ્ટ્રીય મૂળને ધ્યાનમાં લીધા વિના આપવામાં આવે છે.

## યોગ્યતા

Baxter ગ્લોબલ સ્કોલરશિપ પ્રોગ્રામ(Baxter Global Scholarship Program)ના અરજદારો નીચે મુજબ હોવા જોઈએ:

- આશ્રિત, \* અપરિણીત, અસલ અથવા કાનૂની રીતે દત્તક લીધેલ બાળક, કાનૂની પાલ્ય અથવા Baxter દ્વારા નિર્ધારિત કર્યા અનુસાર Baxter International Inc. (Legacy Hill-romના કર્મચારીઓ સહિત)ના વર્તમાન, સક્રિય કર્મચારીના યોગ્યતા ધરાવતા સાવકા બાળકો હોવા જોઈએ. કર્મચારી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા Baxter's international પેટા કંપનીઓમાંથી એકમાં નોકરી કરતા હોવા જોઈએ અથવા યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક હોવા જોઈએ જેમને Baxterની વિદેશી પેટાકંપનીમાં નિયુક્ત કરવામાં આવ્યા હોય. અરજીની સમયસીમા પૂરી થયે કર્મચારીએ Baxter દ્વારા નિર્ધારિત કર્યા અનુસાર ઓછામાં ઓછા બે (2) વર્ષની કુલ-ટાઇમ અથવા નિયમિત પાર્ટ-ટાઇમ સર્વિસ પૂરી કરેલી હોવી જોઈએ. નિવૃત્ત કર્મચારીઓના બાળકો યોગ્યતાને પાત્ર નથી.  
*\*આશ્રિત બાળકોને અસલ, કાનૂની રીતે દત્તક લીધેલા અથવા કર્મચારીના કાનૂની પાલ્ય રૂપે; જેમના જીવનસાથી પાસે કાનૂની કબજો અથવા પ્રાથમિક નાણાકીય સહાયતા પૂરી પાડતા હોય તેવા કર્મચારીના સાવકા બાળક અથવા જેમની પાસે કાનૂની કબજો હોય અથવા પ્રાથમિક નાણાકીય સહાયતા પૂરી પાડતા હોય તેવા ઘરેલું ભાગીદારના બાળક રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.*
- જેના માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તે શૈક્ષણિક વર્ષ દરમિયાન હાઇ સ્કૂલ સિનિયર/અપર સેકન્ડરી સ્કૂલ, હાઇ સ્કૂલ/અપર સેકન્ડરી સ્કૂલ ગ્રેજ્યુએટના તેમના અંતિમ વર્ષના વિદ્યાર્થી હોય અથવા એવા અંડરગ્રેજ્યુએટ હોય જે માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી અથવા વોકેશનલ ટેકનિકલ/પોલિટેકનિક સંસ્થામાં અભ્યાસના કુલ ટાઇમ\* અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવવાના હોય અથવા પ્રવેશ મેળવવાની યોજના કરી રહ્યાં હોય.  
*\*કુલ-ટાઇમ અભ્યાસને આગામી પૂરા શૈક્ષણિક વર્ષ માટે કુલ-ટાઇમ પ્રવેશ રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.*

- અરજી કરતા સમયે ઉંમર 24 વર્ષ અથવા ઓછી હોવી જોઈએ. ઇઝરાયલના વિદ્યાર્થીઓ 28 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે.

ઉપપ્રમુખો અને તેના ઉપરી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓના બાળકો યોગ્યતાને પાત્ર નથી.

## પુરસ્કાર

જો પ્રાપ્તકર્તા રૂપે પસંદગી કરવામાં આવે તો, તે વિદ્યાર્થી \$3,000 USDનું પુરસ્કાર પ્રાપ્ત કરશે. આ પ્રોગ્રામ ખૂબ જ સ્પર્ધાત્મક છે અને **પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે યોગ્યતા ધરાવતા ટોચના ફક્ત 25% અરજદારોને જ પસંદ કરવામાં આવશે.** યોગ્યતાવાળી અરજીઓ પ્રાપ્ત થયા પછી.

પુરસ્કારોને વધારાના ત્રણ વર્ષો સુધી અથવા સ્નાતક (અથવા તેને સમકક્ષ) ડિગ્રી પ્રાપ્ત ના કરવામાં આવે ત્યાં સુધી, જે પહેલા થાય ત્યાં સુધી રિન્યૂ કરવામાં આવી શકે છે. રિન્યૂઅલ એ યોગ્યતાની જરૂરીયાતોના સંતોષવા, અભ્યાસના કુલ-ટાઇમ કોર્સમાં સંતોષકારક શૈક્ષણિક પ્રદર્શન અને Baxter International Foundation દ્વારા આ પ્રોગ્રામને ચાલુ રાખવા પર આધાર રાખે છે.

એવા પ્રાપ્તકર્તાઓ જે યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી અકેડેમી પ્રવેશ મેળવે તે ફક્ત એક જ વાર \$3,000 USDનો પુરસ્કાર મેળવવાને પાત્ર રહેશે.

પુરસ્કાર પ્રાપ્ત ના કરે તેવા વિદ્યાર્થીઓ યોગ્યતાની જરૂરીયાતોને સંતોષે નહીં ત્યાં સુધી દર વર્ષે ફરી અરજી કરી શકે છે.

પુરસ્કારો ઉપસ્નાતક અભ્યાસ માટે છે અને તેનો ઉપયોગ ફક્ત શિક્ષણ સંબંધી યોગ્ય ખર્ચાઓ (ટ્યુશન, ફી, પુસ્તકો અને જરૂરી સપ્લાયો) માટે જ કરી શકાય છે.

## પ્રાપ્તકર્તાઓની પસંદગી

શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓની પસંદગી નીચેની બાબતોના આધારે કરવામાં આવે છે:

- શૈક્ષણિક રેકોર્ડ
- શાળા અને કમ્યુનિટીની પ્રવૃત્તિઓમાં દાખલેલા નેતૃત્વ અને સહભાગીતા
- સન્માન
- શૈક્ષણિક અને કારકિર્દીના લક્ષ્યો તેમજ ઉદ્દેશોના વિધાન
- અસાધારણ વ્યક્તિગત અથવા કૌટુંબિક સંજોગો

નાણાકીય જરૂરીયાતને ધ્યાનમાં લેવામાં આવી ના હોય.

પ્રાપ્તકર્તાઓની પસંદગી સ્કોલરશિપ અમેરિકા દ્વારા કરવામાં આવે છે. **પસંદગીની આ પ્રક્રિયામાં Baxter International Foundation અથવા Baxter International Inc.ના કોઇપણ અધિકારી અથવા કર્મચારી કોઇપણ પ્રકારની ભૂમિકા ભજવતા નથી.** આ પ્રોગ્રામના બધા અરજદારોની પ્રાપ્તકર્તાઓ રૂપે પસંદગી કરવામાં આવશે નહીં. બધા પ્રાપ્તકર્તાઓ નિર્ણયને અંતિમ નિર્ણય રૂપે સ્વીકારવા સંમત થાય છે.

## સૂચના

બધા પ્રાપ્તકર્તાઓને જુનમાં ઈમેલ દ્વારા સૂચિત કરવામાં આવશે. પ્રાપ્તકર્તાઓએ પુરસ્કાર સ્વીકારવો અને તેમના પ્રવેશની ખરાઈ કરવી જરૂરી છે.

## શિષ્યવૃત્તિઓનું ચૂકવણી

સ્કોલરશિપ અમેરિકા Baxter International Foundation વતી શિષ્યવૃત્તિની ચૂકવણીઓની પ્રક્રિયા કરે છે. ચૂકવણી એક હપ્તામાં કરવામાં આવે છે.

સ્કોલરશિપ અમેરિકા યુ.એસ., કેનેડા અને પુર્તો રિકોના શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓની શાળાને ચૂકવવાપાત્ર પુરસ્કારો વિતરીત કરે છે. પ્રવેશનો પૂરાવો અને વાયર ફોર્મ પ્રાપ્ત થઈ ગયા પછી બીજા બધા યુ.એસ. બહારના શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓને પુરસ્કારો વાયર કરવામાં આવે છે.

## જરૂરી દસ્તાવેજો

તમારી અરજીના ભાગ રૂપે, તમારે નીચેના દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી છે:

- ગ્રેડનું વર્તમાન અને પૂરું ટ્રાન્સક્રિપ્ટ. ગ્રેડ રિપોર્ટ સ્વીકારવામાં આવતા નથી. ટ્રાન્સક્રિપ્ટમાં વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, ગ્રેડ અને પ્રત્યેક કોર્સ માટેના ક્રેડિટ કલાકો અને લીધેલા પ્રત્યેક કોર્સની ટર્મ દેખાવી જોઈએ.

**નોંધ:** જો તમે SAT અથવા ACT ટેસ્ટ સ્કોર પૂરા પાડી રહ્યાં હો અને તે સ્કોર તમારા હાઇ સ્કૂલના ટ્રાન્સક્રિપ્ટમાં સૂચિબદ્ધ કરેલ ના હોય તો, તમારે તે ટેસ્ટ સ્કોરની અલગથી એક અધિકૃત નકલ અપલોડ કરવી જરૂરી રહેશે. જો તમે કોલેજ ટ્રાન્સક્રિપ્ટ અપલોડ કરી રહ્યાં હો તો, તે સ્કોર જરૂરી નથી.

- **યુ.એસ. બહારના વિદ્યાર્થીઓ:** શૈક્ષણિક સિસ્ટમોના તફાવતને કારણે યુ.એસ. અને કેનેડા સિવાયના દેશોના અરજદારો દ્વારા નીચેની સામગ્રીઓ પૂરી પાડવામાં આવવી જોઈએ:
  - બધા બિન-અંગ્રેજી દસ્તાવેજોનું અંગ્રેજી ભાષાંતર
  - છેલ્લા ચાર વર્ષોના નીચેના શૈક્ષણિક દસ્તાવેજોની સુવાચ્ય નકલો:
    - શૈક્ષણિક રેકોર્ડ (ગ્રેડના ટ્રાન્સક્રિપ્ટ)
    - જો પ્રાપ્ત કરેલ હોય તો, સેકન્ડરી સ્કૂલ ક્રીડેન્શિયલ્સ/ડિપ્લોમા/સર્ટિફિકેટ અને
    - શૈક્ષણિક પરિક્ષાઓના પરિણામો

તમારી અરજીને ત્યાં સુધી પૂરી **માનવામાં આવતી નથી** જ્યાં સુધી બધા દસ્તાવેજોને આ પ્રોગ્રામની સમયસીમાની અંદર ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવામાં ના આવે.